

RAN-1801130701010001 / 2501005501010001
M.A. (Economics)(Semester-I) Examination March - 2026
Micro Economics-I

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દશવિલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book. (2) પ્રશ્ન નં-1 ફરજિયાત છે. (3) પ્રશ્ન નં-4 માં કોઈપણ બે ટૂંકનોંધ લખો. (4) પ્રત્યેક પ્રશ્નના ગુણ જમણી બાજુ દર્શાવ્યા છે.	Seat No.: <table border="1" style="width: 100%; height: 30px; border-collapse: collapse;"> <tr> <td style="width: 15%;"></td> <td style="width: 15%;"></td> <td style="width: 15%;"></td> <td style="width: 15%;"></td> <td style="width: 15%;"></td> <td style="width: 15%;"></td> </tr> </table> Student's Signature						

- | | | |
|---------------|--|-----------|
| પ્ર-1. | નીચેના પ્રશ્નનો ટૂંકમાં જવાબ આપો.
1) તટસ્થ રેખાની બે લાક્ષણિકતાઓ જણાવો.
2) ઉત્પાદન વિધેયના પ્રકાર જણાવો.
3) કિંમત ભેદભાવયુક્ત ઈજારામાં ઈજારદાર કઈ પરિસ્થિતિમાં ઊંચી કિંમત વસૂલ કરી શકે છે ?
4) જોખમ અને અનિશ્ચિતતાનો તફાવત જણાવો.
5) કદના વળતરના સ્વરૂપ જણાવો. | 10 |
| પ્ર-2. | સ્વટ્સકી અને હિક્સના ખ્યાલ વચ્ચે શું તફાવત છે? બંને સિદ્ધાંતોમાં ધારણા અને ગ્રાહકના વર્તનના અભિગમનું તુલનાત્મક વિશ્લેષણ કરો.
<p align="center">અથવા</p> ન્યૂનતમ ખર્ચ સંયોજન એટલે શું? શા માટે પેઢી ન્યૂનતમ ખર્ચ સંયોજન પસંદ કરે છે? આકૃતિની મદદથી સમજાવો. | 13 |
| પ્ર-2. | ન્યૂનતમ ખર્ચ સંયોજન એટલે શું? શા માટે પેઢી ન્યૂનતમ ખર્ચ સંયોજન પસંદ કરે છે? આકૃતિની મદદથી સમજાવો. | 13 |
| પ્ર-3. | કિંમત ભેદભાવના પ્રકારો અને કક્ષાઓ સમજાવી. કિંમત ભેદભાવ ક્યારે નફાકારક બને છે તે સમજાવો.
<p align="center">અથવા</p> જોખમ અને અનિશ્ચિતતાની વ્યાખ્યા આપી. જોખમની માપણીની પદ્ધતિઓ ઉદાહરણ સહીત સમજાવો | 13 |
| પ્ર-3. | જોખમ અને અનિશ્ચિતતાની વ્યાખ્યા આપી. જોખમની માપણીની પદ્ધતિઓ ઉદાહરણ સહીત સમજાવો | 13 |
| પ્ર-4. | ટૂંક નોંધો લખો. (કોઈ પણ બે)
1) ઘટતા સીમાંત અવેજીના દરનો નિયમ.
2) સમ ઉત્પાદન રેખાના લક્ષણો.
3) પૂર્ણ હરીફાઈમાં કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક વચ્ચેના સંબંધો.
4) નૈતિક સંકટ. | 14 |

ENGLISH VERSION

- Q-1. Answer the following in brief. 10**
- 1) State any two characteristics of an indifference curve.
 - 2) State the types of production function
 - 3) Under price-discriminating monopoly, in which situation monopolist can charge higher price?
 - 4) Explain the difference between risk and uncertainty.
 - 5) State the features of returns to scale.
- Q-2. What is the difference between Slutsky and Hicks concepts? Make a comparative analysis of the approach to perception and consumer behavior in both theories. 13**
- OR**
- Q-2. What is least cost combination? Why does a firm choose least cost combination? Explain with the help of diagram 13**
- Q-3. Explain the types and degrees of price discrimination, and explain the conditions under which price discrimination becomes profitable 13**
- OR**
- Q-3. Give the definition of Risk and Uncertainty. Explain the methods of risk measurement with examples. 13**
- Q-4. Write short notes. (Any Two) 14**
- 1) Law of Diminishing Marginal Rate of Substitution.
 - 2) Characteristics of Isoquant Curve.
 - 3) Relationship between Total Revenue (TR), Average Revenue (AR) and Marginal Revenue under perfect competition.
 - 4) Moral Hazard.
-